

**January 28, 2020**

To,  
**The Secretary,**  
Department of Corporate Services,  
BSE Limited,  
25th Floor, Phiroj Jeejeebhoy Tower,  
Dalal Street, Fort,  
Mumbai: 400 001

Dear Sir/Madam,

Ref: **Company Code: 539384**


Sub: **Newspaper Publication: Un-Audited Financial Results for the Quarter Ended  
December 31, 2019**

As required under Regulation 47 of SEBI (LODR), Regulations, 2015, please find enclosed herewith newspaper advertisement Dated **25/01/2020** as published under the Companies Act, 2013 and rules made there under in Lok Mitra (Vernacular Language) and Freepress (English daily) in connection with the un-audited Financial Results for the Quarter Ended **December 31, 2019**.

Kindly take the same on record.

Thanking you,

Yours faithfully,  
For, **Krishna Capital & Securities Limited**

  
**Ashokkumar Agrawal**  
**(Managing Director)**  
(DIN 00944735)



## MYBYK expands 30 bicycle hubs in Ahmedabad with a fixed monthly subscription

Ahmedabad: MYBYK, an Ahmedabad based company providing sustainable mobility solutions, is now looking to expand aggressively in the entire city of Ahmedabad. It applied for and received permits under the 'Amdabike' project of Smart City Ahmedabad Development Limited (SCADL) to provide its fully automated IoT enabled dockless bicycle sharing service. The company has already set up a network of 30 HUBS connecting to the BRTS in Ahmedabad where users can DROP the bike at the boarding station and similarly PICK up another bike from the station where they alight to go to their destination. For this the company has already deployed a fleet of 500 cycles and another 500 cycles are on their way. Over the coming months, MYBYK plans to connect to all the remaining BRTS and AMTS stations as well as upcoming Metro (in future). (19-10)

## Gujarat Exports can be doubled in 2 years



Ahmedabad: US \$ 107 billion is the size of untapped potential of exports that can be exported from Gujarat with some focussed efforts, stated Mr. Vinod Kumar Wuthoo, the President of India SME Forum, India's Largest Organisation for SMEs. He continued to state that, Marine, Cement, Pharmaceuticals, Textiles, Cotton, Chemicals, Machinery and Equipment, and Minerals are some of the sectors that have potential and it can easily double its present share of 20% in India's exports. The current exports from Gujarat are around US \$ 56 Billion, mainly through major commodities exported including Petroleum Products, Drug Formulations, Plastic Raw materials, Organic Chemicals, Gold & other precious Metals, Products of Iron & Steel. He further said that "There are huge trade opportunities in the global domain, however, it's easier said than done. In spite of Government's strong focus on SMEs and exports, only less than 0.01% of total 65 Million of Indian MSMEs currently participate in Exports or Global Trade. In association with the support of the Ministry of MSME, India SME Forum has decided to sensitise around 4,00,000 SMEs for Exports and to enable a new crop of Internationally competitive Indian SMEs to double the export output from India in the next four years and we are associating with ICICI a premier export financing and enabling bank to bring about this transformation."

## ETIHAD AVIATION TRAINING FIRST IN MID-EAST



Ahmedabad: The specialist aviation training division of Etihad Aviation Group, has become the first aviation company in the Middle East to gain approval from the European Aviation Safety Agency (EASA) to train Boeing 777 and 787 pilots for European operators and carriers elsewhere which adopt Europe's air safety standards. The approval to train pilots for these two wide-bodied Boeing aircraft types expands the global capabilities of Etihad Aviation Training, which in 2018 also became the first Middle Eastern aerospace business to gain EASA designation as an Approved Training Organisation for pilots of Airbus A320, A330 and A340 aircraft. (19-10)

## "Ananya Panday doesn't have a good answer on nepotism but I do", says Alaya F

Ahmedabad: All set to make her Bollywood debut, Alaya F (Furniturewala) has already captured the audience's attention with her effortless beauty and glamorous looks. A picture-perfect arrant millennial and the decade's first debutant shows off her sassy side as she joins the host Renil Abraham, in the upcoming episode of By Invite Only on zoOm, airing this Saturday, January 25 at 7:30 pm.

In a #NothingToHide conversation, Alaya reveals her witty side, tells about the one thing she has and Ananya doesn't, "Ananya Panday doesn't have a good answer on nepotism but I do."


Praising Tara for her perfection and poise, Alaya



had a tough time reckoning that one thing she has and Tara doesn't. Giving a rationale response she said, "I am very new in the Industry, no piece of my work is out there in audience, so one thing that I have but Tara doesn't is a clean slate." (19-8)

## Let every voter in India exercise their right to vote

National Voters Day is celebrated on January 25 every year since 2011. The national voter's day is undoubtedly a step forward in encouraging the right practices in the electoral system. National Voters day marks the foundation of Election Commission of India which was laid on 25th of January, 1950. Every year, the government proposes a new theme to draw more youngsters to come forward and enroll themselves in the electoral rolls of the country. The aim is to encourage our voters to participate enthusiastically in the democratic process. And that is why the relevance of this day is even more pronounced on the eve of Republic Day. Young voters who have just turned 18 and got the right to vote for the first time. "Our Constitution empowers an independent Election Commission. And our election process makes every vote important, with the right to equality and freedom. A government is selected by voting in an election, which is every citizen's right to choose among several candidates for ruling their constituency. Voting generally takes place in polling booths. The constitution of India places utmost importance on maintaining the dignity of the voter. He has all the rights to cast votes according to his likes and dislikes. As such Indian democracy is known through the world for its maturity and stability." NVD is celebrated all over the country right from the national level to the far remote corners of our country down to each Polling Station location where new voters were felicitated with a badge carrying the logo 'Proud to be a Voter- Ready to Vote'.



administered the Pledge and handed over their Elector Photo Identity Cards (EPICs).

India is the largest democracy in the world. Every citizen of this country is provided with basic rights to vote. He can exercise his franchise to select the leader he thinks is capable of leading the nation and bringing about a change. Voting is very important as it lets you decide and give your opinion about the choice of your leader. As a result it brings up your voting rights which every citizen above the age of 18 has got in every country. It is also said that wrong political parties are not won by the number of votes they received, but they win by the number of people who did not vote the correct or the good political parties. The day is very significant

in the roots of India because the future of our country lies in the leaders we select today. A vote is a choice made by a particular group or a person in a meeting or an election. It is a means to express one's views in response to a poll. One must remember that when we vote, we give our opinion which is very important. Everyone has the right to vote because voting rights are constitutional rights. On this occasion let us encourage each and every voter in the country to exercise their right to vote. He lauded in their efforts to inspire the younger generation to come forward and vote and hoped even in the future; elections would be organized in a disciplined conduct.

Vinod Chandrashekar Dixit  
dixitpatrakar@yahoo.in  
B-15 Jyoti-Kalash Society,  
Jodhpur Tekra Satellite  
Ahmedabad - 380015

## In a first, 100 set to take diksha together in Surat on February 1

SURAT: Diamond City will create a record of sorts in asceticism when more than 100 individuals will take up monkhood on February 1. The events for taking vows for diksha are going to take place in different places in the city with the biggest of them being organized in Vesu. Around 75 individuals will take diksha in Vesu to become Jain sadhus and sadhis, sources said. The other events will take place in Adajan and Pal areas of the city on the same day. At Vesu, 75 individuals will take diksha under the guidance of Vijay Shreyanshprabhsuriswarji Maharaja; muhurat for 71 has already been decided while a few others are in the waiting. "So far we have finalized muhurat for 71 diksharthi. The figure is likely to go up. These individuals have come from across the country - Karnataka, Rajasthan, Maharashtra and different cities of Gujarat - and also from varied backgrounds," said Naresh Shah of Diksha Utsav Samiti.

The vows will be given by Vijay Shreyanshprabhsuriswarji Maharaja, Tapornasuriswarji Maharaja and Kalyanratnasuriswarji Maharaja, he said. In December 2014, in a mass diksha event had taken place in which 45 individuals had renounced the world in the city. So far, that was the biggest of such events. "The event organized by Jinagna Trust is biggest in the history of dikshas the country as well as in Jain religion when so many individuals are taking up monkhood," Shah added. A Varshdan Yatra - procession to celebrate the monkhood organized a day before the main event - will take place on January 31.

**ASHISH POLYPLAST LIMITED**  
CIN: L17110GJ1994PLC021391  
Registered Office: A- 305, Samudra Complex, Opp.Emirates Airlines Office, Off C G Road, Ahmedabad, Gujarat, 380009  
Phone(O) 26445495, 26445090  
Email: ashishpolyplast@gmail.com  
Website: www.ashishpolyplast.com

### Notice

Notice is hereby given pursuant to Regulation 47(1)(a) that in terms of Regulation 29(1)(a) read with Regulation 33(3)(d) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a Meeting of Board of Directors of the Company is scheduled to be held on Tuesday, the February 04, 2020 at its Registered Office at 5:30 pm, inter alia to consider and approve the Unaudited Financial Results for the 3rd Quarter and Nine Months ended on 31st December 2019.

The Trading windows on the exchange will remain closed for the Director, Key managerial Persons and their Relatives, Promoters and their Relatives till 48 hours after the announcement of financial results to stock exchange. Notice is also available on website of the Company at www.ashishpolyplast.com and also at the Stock Exchange Website at www.bseindia.com.

For Ashish Polyplast Limited  
Sd/-  
Ashish D Panchal  
Managing Director  
DIN:00598209

Date: January 26, 2020  
Place: AHMEDABAD



**SAGARDEEP ALLOYS LIMITED**  
(CIN: L29253GJ2007PLC050007)  
Reg. Office.: Plot No. 2070, Rajnagar Patiya, Santej/Khatraj Road, Kalol Gandhinagar - 382721  
Email: secretary@sdalloys.com Website: www.sdalloys.com

### NOTICE

Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors (06/2019-20) of the Company will be held on Monday, 03rd February, 2020 at the Registered Office of the Company to consider and approve inter alia, un-audited Standalone and Consolidated Financial Results of the Company for the quarter ended on 31st December, 2019 and to transact the other businesses mentioned in the Board Meeting Notice.

The said notice is also available on the website of the Company at www.sdalloys.com and on the website of Stock Exchange where shares of the Company are listed i.e. www.nseindia.com.

By Order of the Board  
Sd/-  
SATISHKUMAR MEHTA  
Managing Director  
(DIN: 01958984)

Place: Santej  
Date: 25th January, 2020

## PHYSICAL POSSESSION NOTICE

**ICICI Home Finance**  
Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No 1 Plot No -B3, WIFI IT Park, Wagle Industrial Estate, Thane, Maharashtra - 400604

Whereas The undersigned being the Authorized Officer of ICICI Home Finance Company Limited under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued demand notices upon the borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/ her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of ICICI Home Finance Company Limited.

Sr. No.	Name of the Borrower/ Loan Account Number	Description of Property/ Date of Physical Possession	Date of Demand Notice/ Amount in Demand Notice (Rs.)	Name of Branch
1.	Dhanraj B Rathi / Jyoti Rathi - NHSUR00000796166	Flat No. A-101, 1st Flr, Tower A, Vivek Residency, R.S. No.18/1, Block No. 24, Nr. Pashupatinath Mahadev Temple, Saroli, Vill: Saniya-hernad, Surat, Gujarat - 395006, January 22, 2020	May 5, 2018 Rs. 9,46,456.00/-	Gujarat

The above-mentioned borrowers(s)/ guarantors(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date: 25-01-2020  
Place: Gujarat  
Authorized Officer  
ICICI Home Finance Company Limited

## Siemens Healthineers launches ACUSON Redwood Ultrasound System



Ahmedabad: At the 73rd Annual Conference of Indian Radiological & Imaging Association (IRIA) 2020, Gandhinagar, Siemens Healthineers launched the ACUSON Redwood Ultrasound System. The system is built on the company's new platform architecture and features advanced applications for greater clinical confidence, AI-powered tools for smart workflows and has shared services cardiology features used by different hospital departments. These features, along with a portable and lightweight design, offer efficient high-performing imaging solution. "We are seeing an increased demand for premium medical imaging services being driven by the growing healthcare needs of a population with varied requirements, particularly in regard to chronic diseases," says Vivek Kanade, Executive Director, Siemens Healthineers India. We worked together with inputs from users to transform care delivery with the ACUSON Redwood and meet these challenges. This system is designed to deliver premium image quality, exceptional performance, and greater workflow efficiency." (19-10)

Particulars	Quarter Ended				Nine Month Ended		Year Ended
	31/12/2019 (Audited)	30/09/2019 (Unaudited)	31/12/2018 (Unaudited)	31/12/2019 (Unaudited)	31/12/2018 (Audited)	31/03/2019 (Audited)	
<b>Month Covered</b>	3	3	3	9	9	12	
<b>Revenue From Operation</b>	10.11	4.94	7.17	21.33	13.74	46.60	
Other Operation Income	-	-	-	-	0.00	0.00	
<b>Total Income From Operating Income</b>	10.11	4.94	7.17	21.33	13.74	46.60	
Other Income	0.00	0.00	-	0.00	0.11	0.11	
Net Gain on Recognition of Financial Assets at Amortized Cost	-	-	-	-	-	-	
Net Gain on Reclassification of Financial Assets	-	-	-	-	-	-	
<b>Total Income [(II)-(III)-(IV)]</b>	10.11	4.94	7.17	21.33	13.85	46.71	
<b>Expenditure</b>	-	-	-	-	-	-	
Cost of Material Consumed	-	-	-	-	-	-	
Purchase of Stock in Trade	-	-	-	-	-	-	
Changes in Inventories of Finished Goods, Stock-in-Trade and Work-in-progress	-	0.02	(0.02)	0.12	0.06	9.36	
Employees Benefits Expenses	2.52	3.36	0.83	7.56	2.15	3.30	
Finance Cost	-	-	-	-	-	-	
Depreciation & Amortisation Expenses	0.01	0.01	0.01	0.03	0.03	0.04	
Others Expenses	0.14	2.02	0.15	7.10	7.02	8.43	
<b>Total Expenses (VI)</b>	2.67	5.41	0.97	14.81	9.26	21.13	
<b>Profit/(Loss) Before Exceptional Items (V-VI)</b>	7.44	(0.47)	6.20	6.52	4.59	25.58	
Exceptional Items	-	-	-	-	-	-	
<b>Profit / (Loss) Before Tax (VII-VIII)</b>	7.44	(0.47)	6.20	6.52	4.59	25.58	
<b>Tax Expenses</b>	-	-	-	-	-	-	
Current Tax	-	-	-	-	-	4.99	
Deferred Tax	-	-	-	-	-	0.01	
<b>Profit / (Loss) For The Period From Continuing Operation (IX)</b>	7.44	(0.47)	6.20	6.52	4.59	20.58	
Profit / (Loss) For The Period From Discontinuing Operation	-	-	-	-	-	-	
Tax Expenses of Discontinued Operations	-	-	-	-	-	-	
<b>Profit / (Loss) For The Period From Discontinuing Operation After Tax (XII-XIII)</b>	-	-	-	-	-	-	
<b>Profit / (Loss) For The Period (XI-XIV)</b>	7.44	(0.47)	6.20	6.52	4.59	20.58	
<b>Other Comprehensive Income</b>	-	-	-	-	-	-	
Items That Will Not be Reclassified to Profit or Loss	-	-	-	-	-	-	
Income Tax Relating to Items That Will Not Be Reclassified to Profit or Loss	-	-	-	-	-	-	
Items That Will be Reclassified to Profit or Loss	-	-	-	-	-	-	
Income Tax Relating to Items That Will be Reclassified to Profit or Loss	-	-	-	-	-	-	
<b>Total Comprehensive Income For The Period (XV-XVI)</b>	7.44	(0.47)	6.20	6.52	4.59	20.58	
<b>Point on Equity Share Capital Face value Rs. 10/-</b>	315.84	315.84	315.84	315.84	315.84	315.84	
<b>Earning Per Share (EPS) For Continuing Operation</b>	0.24	(0.01)	0.20	0.21	0.15	0.65	
<b>Basic</b>	0.24	(0.01)	0.20	0.21	0.15	0.65	
<b>Diluted</b>	0.24	(0.01)	0.20	0.21	0.15	0.65	

Notes: 1. The above Unaudited Financial Result has been reviewed by the Audit Committee and thereafter Approved by the Board of Director at their Meeting held on 25/01/2020.

2. The Limited Review Report for the Quarter Ended on 31/12/2019 has been carried out by the Statutory Auditor, as required under Regulation 33 of SEBI (LODR) Regulation, 2015.

3. The Company is Operating in Single Segment, so above Unaudited Financial Result are for Single Segment Only.

4. The Figure of the Previous Period has been Regrouped or Reclassified, wherever necessary.

### CONSOLIDATE UNAUDITED FINANCIAL RESULT FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2019

Particulars	Quarter Ended				Nine Month Ended		Year Ended
	31/12/2019 (Unaudited)	30/09/2019 (Unaudited)	31/12/2018 (Unaudited)	31/12/2019 (Unaudited)	31/12/2018 (Audited)	31/03/2019 (Audited)	
<b>Month Covered</b>	3	3	3	9	9	12	
<b>Revenue From Operation</b>	10.11	4.94	7.17	21.33	13.74	46.60	
Other Operation Income	-	-	-	-	0.00	0.00	
<b>Total Income From Operating Income</b>	10.11	4.94	7.17	21.33	13.74	46.60	
Other Income	0.00	0.00	-	0.00	0.11	0.00	
Net Gain on Recognition of Financial Assets at Amortized Cost	-	-	-	-	-	-	
Net Gain on Reclassification of Financial Assets	-	-	-	-	-	-	
<b>Total Income [(II)-(III)-(IV)]</b>	10.11	4.94	7.17	21.33	13.85	46.71	
<b>Expenditure</b>	-	-	-	-	-	-	
Cost of Material Consumed	-	-	-	-	-	-	
Purchase of Stock in Trade	-	-	-	-	-	-	
Changes in Inventories of Finished Goods, Stock-in-Trade and Work-in-progress	-	0.02	(0.02)	0.12	0.06	9.36	
Employees Benefits Expenses	2.52	3.36	0.83	7.56	2.15	3.30	
Finance Cost	-	-	-	-	-	-	
Depreciation & Amortisation Expenses	0.01	0.01	0.01	0.03	0.03	0.04	
Others Expenses	0.14	2.02	0.15	7.10	7.02	8.43	
<b>Total Expenses (VI)</b>	2.67	5.41	0.97	14.81	9.26	21.13	
<b>Profit/(Loss) Before Exceptional Items (V-VI)</b>	7.44	(0.47)	6.20	6.52	4.59	25.58	
Share of Profit / (Loss) of an Associates	-	-	-	-	-	2.48	
Exceptional Items	-	-	-	-	-	-	
<b>Profit / (Loss) Before Tax (VII-VIII)</b>	7.44	(0.47)	6.20	6.52	4.59	28.06	
<b>Tax Expenses</b>	-	-	-	-	-	-	
Current Tax	-	-	-	-	-	4.99	
Deferred Tax	-	-	-	-	-	0.01	
<b>Profit / (Loss) For The Period From Continuing Operation (IX)</b>	7.44	(0.47)	6.20	6.52	4.59	23.06	
Profit / (Loss) For The Period From Discontinuing Operation	-	-	-	-	-	-	
Tax Expenses of Discontinued Operations	-	-	-	-	-	-	
<b>Profit / (Loss) For The Period (XI-XIV)</b>	7.44	(0.47)	6.20	6.52	4.59	23.06	
<b>Other Comprehensive Income</b>	-	-	-	-	-	-	
Items That Will Not be Reclassified to Profit or Loss	-	-	-	-	-	-	
Income Tax Relating to Items That Will Not Be Reclassified to Profit or Loss	-	-	-	-	-	-	
Items That Will be Reclassified to Profit or Loss	-	-	-	-	-	-	
Income Tax Relating to Items That Will be Reclassified to Profit or Loss	-	-	-	-	-	-	
<b>Total Comprehensive Income For The Period (XV-XVI)</b>	7.44	(0.47)	6.20	6.52	4.59	23.06	
<b>Point on Equity Share Capital Face value Rs. 10/-</b>	315.84	315.84	315.84	315.84	315.84	315.84	
<b>Earning Per Share (EPS) For Continuing Operation</b>	0.24	(0.01)	0.20	0.21	0.15	0.73	
<b>Basic</b>	0.24	(0.01)	0.20	0.21	0.15	0.73	
<b>Diluted</b>	0.24	(0.01)	0.20	0.21	0.15	0.73	

Notes: 1. The above Unaudited Consolidated Financial Result has been reviewed by the Audit Committee and thereafter Approved by the Board of Director at their Meeting held on 25/01/2020.

2. The Limited Review Report for the Quarter Ended on 31/12/2019 has been carried out by the Statutory Auditor, as required under Regulation 33 of SEBI (LODR) Regulation, 2015.

3. The Company is Operating in Single Segment, so above Unaudited Financial Result are for Single Segment Only.

4. The Figure of the Previous Period has been Regrouped or Reclassified, wherever

